

**Date: May 29, 2025**

**To**  
**BSE Limited**  
P J Towers,  
Dalal Street,  
Mumbai – 400 001  
**Scrip Code: 544318**

**To**  
**The National Stock Exchange of India Limited**  
“Exchange Plaza”,  
Bandra – Kurla Complex,  
Bandra (E), Mumbai – 400 051  
**Scrip Code: MAMATA**

Dear Sir,

**Sub: Newspaper Publication of Audited financial results of the Company for the quarter and year ended March 31, 2025**

We herewith enclose copies of newspaper advertisement regarding extract of the audited financial results of the Company for the quarter and year ended March 31, 2025, published in ‘Financial Express (English)’ and ‘Financial Express (Gujarati)’ on May 29, 2025.

This Disclosure is made in terms of requirements of Regulation 30 and 47(3) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The above information is also available on the website of the Company [www.mamata.com](http://www.mamata.com). You are requested to take the same on your record.

Thanking You

Yours Faithfully,

**For, Mamata Machinery Limited**

**Madhuri Sharma**  
**Company Secretary & Compliance Officer**

---

**MAMATA MACHINERY LIMITED**

(Formerly Known as Mamata Machinery Private Limited)

Survey No.423/P, Sarkhej-Bavla Road, Moraiya, Tal: Sanand, Dist: Ahmedabad-382 213, Gujarat, India.

Phone : +91-2717-630800, E-mail : [info@mamata.com](mailto:info@mamata.com),

Website : <http://www.mamata.com> CIN - U29259GJ1979PLC003363









| GLITTEK GRANITES LIMITED. Registered Office: Plot No. 42, KIADB Industrial Area, Hoskote, Bangalore-562114. www.glittek.com, Email: info@glittek.com CIN: L14102KA1990PLC023497 |                                                                                                            |                                            |                                                                        |                                                                        |                                 |
|---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------|------------------------------------------------------------------------|------------------------------------------------------------------------|---------------------------------|
| Extract of the Audited Financial Results for the Year ended March 31, 2025                                                                                                      |                                                                                                            |                                            |                                                                        |                                                                        |                                 |
| (Rs. in Lakhs, except share and per share data, unless otherwise stated)                                                                                                        |                                                                                                            |                                            |                                                                        |                                                                        |                                 |
| Sl. No.                                                                                                                                                                         | Particulars                                                                                                | For the Quarter ended 31.03.2025 (Audited) | Year to date figures for the current period ended 31.03.2025 (Audited) | Corresponding 3 Months ended in the previous year 31.03.2024 (Audited) | Year ended 31.03.2024 (Audited) |
| 1                                                                                                                                                                               | Total Revenue from Operations (including other income)                                                     | 3,151.87                                   | 3,329.91                                                               | 166.40                                                                 | 705.90                          |
| 2                                                                                                                                                                               | Net Profit for the period (before tax and Exceptional Items)                                               | 2,664.66                                   | 755.86                                                                 | (246.83)                                                               | (614.41)                        |
| 3                                                                                                                                                                               | Net Profit for the period before tax (after Exceptional Items)                                             | 2,664.66                                   | 746.86                                                                 | (246.83)                                                               | (614.41)                        |
| 4                                                                                                                                                                               | Net Profit for the period after tax (after Exceptional Items)                                              | 2,603.66                                   | 685.86                                                                 | (305.50)                                                               | (614.41)                        |
| 5                                                                                                                                                                               | Total Comprehensive Income (Comprising Profit/(Loss) after tax and Other Comprehensive Income (after tax)) | 2,574.01                                   | 657.51                                                                 | (308.23)                                                               | (609.47)                        |
| 6                                                                                                                                                                               | Equity Share Capital (Face value of share: Rs. 5/-)                                                        | 1,329.09                                   | 1,329.09                                                               | 1,329.09                                                               | 1,329.09                        |
| 7                                                                                                                                                                               | Reserves (excluding Revaluation Reserves as shown in the Balance Sheet of previous year)                   | (171.41)                                   | (171.41)                                                               | (832.92)                                                               | (832.92)                        |
| 8                                                                                                                                                                               | Earnings per share of Rs. 10/- each a) Basic & b) Diluted                                                  | 10.03                                      | 2.64                                                                   | (1.18)                                                                 | (2.37)                          |

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the Bombay Stock Exchange website [www.bseindia.com](http://www.bseindia.com) and the Company's website [www.glittek.com](http://www.glittek.com).  
Place: Bangalore, Date: 28.05.2025 By Order of the Board For Glittek Granites Ltd. Ashoke Agawal, Chairman & Managing Director



**Indian Overseas Bank**  
असक्ती प्रवृत्ति का सच्चा सारो Good people to grow with

**Stressed Assets Management Department**  
Central Office, 763, Anna Salai, Chennai – 600 002

**TRANSFER OF NPA LOAN EXPOSURES TO ARCs & OTHER PERMITTED TRANSFERREES THROUGH e-AUCTION UNDER OPEN AUCTION METHOD**

Indian Overseas Bank (IOB) invites Expression of Interest from ARCs and Other Permitted Transferees for the proposed transfer of **NPA loan Exposures in respect of the account: M/s D R Hotels and Resorts (Nellore/Tirupati) under Open Auction method on "as is where is" and "as is what is" basis "without any recourse" to the Bank.**

Interested eligible bidders are requested to intimate their willingness to participate in the **e-Auction scheduled on 12.06.2025** by way of an **"Expression of Interest"** to the email id [saletoarc@lobnet.co.in](mailto:saletoarc@lobnet.co.in) on or before **04.06.2025**.

For further details please visit our Bank's website ([www.iob.in](http://www.iob.in)) click on **TENDERS->ARC->Cell->Notification dated 28.05.2025** for account: **M/s D R Hotels and Resorts (Nellore/Tirupati)**

IOB reserves the right to cancel or modify the process and amend any of the terms of the notification at any stage and the same will not necessarily be carried out through advertisement but will be notified directly on the Bank's website.

**Place: Chennai**  
**Date: 28.05.2025**

**General Manager**



**YUKEN INDIA LIMITED**

Registered Office: No. 16-C, Doddanekundi Industrial Area II Phase, Mahadevapura, Bangalore-560048, Karnataka. Tel No: +91 9731610341; E-mail: [csyil@yukenindia.com](mailto:csyil@yukenindia.com); Website: [www.yukenindia.com](http://www.yukenindia.com); CIN: L29150KA1976PLC003017

**NOTICE OF POSTAL BALLOT AND REMOTE E-VOTING INFORMATION**

NOTICE is hereby given to the Members of the Company pursuant to the provisions of Sections 108 and 110 of the Companies Act, 2013 ("the Act") read with Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ("the Rules"), Secretarial Standard-2 on General Meetings ("the SS-2"), read with guidelines prescribed by the Ministry of Corporate Affairs ("the MCA") General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, and subsequent circulars issued in this regard, the latest being 09/2024 dated September 19, 2024 issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars"), Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations") and other applicable provisions, of the Act, rules, regulations, circular and notification (including any statutory modification(s), clarification(s), substitution(s) or re-enactment(s) thereof for the time being in force) that the following special business is proposed for consideration by the Members of the Company through Postal Ballot by voting through electronic means ("e-voting"):

| Item No. | Description of the Resolution                                                                                                                                     |
|----------|-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|
| 1        | To Re-appoint Mr. C P Rangachar (DIN: 00310893) as the Managing Director of the Company for a Period of 5 (Five) years with effect from 01 <sup>st</sup> May 2025 |
| 2        | To Create, Offer, Issue and Allot Equity Shares on Preferential Basis                                                                                             |

As per the MCA Circulars, the Company has on May 28, 2025 completed the dispatch of the Postal Ballot Notice to the Members whose names appear on the Register of Members/List of Beneficial Owners as received from the National Securities Depository Limited (NSDL) and Central Depository Services (India) Limited (CDSL) at their registered email ids. Members whose names appeared on the Register of Members/List of Beneficial Owners as on Friday, May 23, 2025 i.e. the cut-off date, will be considered eligible for the purpose of voting. A person who is not a Member as on Friday, May 23, 2025 i.e. the cut-off date for reckoning voting rights, should treat this Notice for Information purposes only. Further, in accordance with the MCA Circulars, Postal Ballot forms and Business Reply Envelopes have not been sent to the Members. The communication of the assent or dissent of the Members would take place through the remote e-voting system only.

Members are requested to register the email id with their concerned DPs, in respect of electronic holding and with KFin Technologies Limited ("KFin"). Further, those Members who have already registered their e-mail addresses are requested to keep their e-mail addresses validated/updated with their DPs / KFin to enable servicing of notices / documents / Annual Reports and other communications electronically to their e-mail address in future.

In compliance with provisions of Section 110 of the Act read with Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, the Company is offering remote e-voting facility to the Members of the Company. The Company has entered into an arrangement with KFin for facilitating remote e-voting services. The login credentials for casting the votes through remote e-voting have been sent to the shareholders along with the Notice of Postal Ballot. The detailed procedure for casting of votes through remote e-voting has been provided in the Notice. The details will also be made available on the website of the Company.

A copy of the Postal Ballot Notice is available on the website of the Company at [www.yukenindia.com](http://www.yukenindia.com), website of the stock exchanges i.e. BSE Limited and National Stock Exchange of India Limited at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com) respectively and on the website of the e-voting agency i.e. KFin Technologies Limited; [www.kfintech.com](http://www.kfintech.com)

The remote e-voting period shall commence on Thursday, 29th May 2025 at 9:00 a.m. and end on Friday, 27th June 2025 at 5:00 p.m. Members may cast their vote electronically during the aforesaid period. The remote e-voting module shall be disabled at 5:00 p.m. on Friday, 27th June 2025 and remote e-voting shall not be allowed beyond the same.

The Board of Directors has appointed Mr. Abhishek Baradwaj AB, Practicing Company Secretary (FCS: 8908 & COP No. 13649) representing AAA & Co., Company Secretaries, as the Scrutiniser for conducting the Postal Ballot process in a fair and transparent manner. The results of the Postal Ballot will be announced on Saturday, June 28<sup>th</sup> 2025. The result would be intimated to the Stock Exchanges where the Company's shares are listed and displayed along with the Scrutiniser's report on the Company's website i.e. [www.yukenindia.com](http://www.yukenindia.com).

In case of any queries, the members can contact Mr. Premkumar Maruturi, KFin Technologies Limited at [premkumar.maruturi@kfintech.com](mailto:premkumar.maruturi@kfintech.com). The Members may also contact the Company's secretarial department by sending an email to [csyil@yukenindia.com](mailto:csyil@yukenindia.com) should you have any unresolved queries.

In case of any query and/or assistance required, Members may refer to the Help & Frequently Asked Questions ("FAQs") available at the download section of <https://evoting.kfintech.com> or contact KFin at the email ID: [evoting@kfintech.com](mailto:evoting@kfintech.com) or call KFin's toll free No.: 1800 309 4001 for any further clarifications/ technical assistance that may be required.

By order of the Board of Directors  
**Yukun India Limited**  
Sd/-  
**Suchithra R**  
Company Secretary & Compliance Officer

**Place: Bengaluru**  
**Date : 28.05.2025**

| <b>MPS PHARMAA LIMITED</b><br>(Formerly Advik Laboratories Limited)<br>Regd. Off: 138, Roz Ka Mac Ind. Area, Sohna, Distt. Mewat, Haryana - 122103<br>CIN : L74999HR1994PLC038300 Tele nos.: 011-4242484, 43571043-45,<br>Website : <a href="http://www.mpspharmaa.com">www.mpspharmaa.com</a> , Email: <a href="mailto:info@mpspharmaa.com">info@mpspharmaa.com</a> |                                    |                                    |                                 |                                 |  |
|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------|------------------------------------|---------------------------------|---------------------------------|--|
| EXTRACT OF STANDALONE AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER & YEAR ENDED 31ST MARCH 2025                                                                                                                                                                                                                                                                         |                                    |                                    |                                 |                                 |  |
| (Rs. in Lacs except EPS)                                                                                                                                                                                                                                                                                                                                             |                                    |                                    |                                 |                                 |  |
| Particulars                                                                                                                                                                                                                                                                                                                                                          | Quarter ended 31.03.2025 (Audited) | Quarter ended 31.03.2024 (Audited) | Year ended 31.03.2025 (Audited) | Year ended 31.03.2024 (Audited) |  |
| Total income from operations                                                                                                                                                                                                                                                                                                                                         | -                                  | 0.24                               | 4.77                            | 9.37                            |  |
| Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)                                                                                                                                                                                                                                                                              | (22.92)                            | (24.75)                            | (86.39)                         | (85.33)                         |  |
| Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)                                                                                                                                                                                                                                                                         | (22.92)                            | (24.75)                            | (86.39)                         | (85.33)                         |  |
| Net Profit / (Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items)                                                                                                                                                                                                                                                                          | (27.95)                            | (24.39)                            | (89.79)                         | (83.10)                         |  |
| Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax))                                                                                                                                                                                                                         | (27.95)                            | (24.39)                            | (89.79)                         | (83.10)                         |  |
| Equity Share Capital                                                                                                                                                                                                                                                                                                                                                 | 1911.14                            | 1911.14                            | 1,911.14                        | 1,911.14                        |  |
| Reserves (including Revaluation Reserve as shown in the Audited Balance Sheet of previous & current year)                                                                                                                                                                                                                                                            | -                                  | -                                  | (1,803.07)                      | (1,714.20)                      |  |
| Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)                                                                                                                                                                                                                                                                                   |                                    |                                    |                                 |                                 |  |
| Basic :                                                                                                                                                                                                                                                                                                                                                              | (0.14)                             | (0.13)                             | (0.47)                          | (0.43)                          |  |
| Diluted:                                                                                                                                                                                                                                                                                                                                                             | (0.14)                             | (0.13)                             | (0.47)                          | (0.43)                          |  |

Note: The above is an extract of the detailed format of Audited Financial Results for the Quarter & Financial year ended March 31, 2025, filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the aforesaid Financial Results is available on the Stock Exchanges websites, viz., [www.bseindia.com](http://www.bseindia.com), [www.nseindia.com](http://www.nseindia.com) and on the Company's website [www.mpspharmaa.com](http://www.mpspharmaa.com) and can also be accessed by scanning the QR Code provided below. The above Audited Financial results are prepared in accordance with the Companies (Ind AS) Rules, 2015.

For and on behalf of the Board of Directors of MPS Pharmaa Limited (Formerly Advik Laboratories Limited) Sd/-  
Peeyush Kumar Aggarwal  
Chairman  
DIN: 00090423

Place: New Delhi  
Date: 28th May, 2025

**UNITED CREDIT LIMITED**

REGISTERED OFFICE: 278, CAMAC STREET, 8TH FLOOR, KOLKATA 700016, WEST BENGAL, INDIA  
PHONE: +91-33-2287-9359, 2287-9360, 2287-9185; FAX: +91-33-2287-2047  
CIN: L65993WB1970PLC027781  
E-mail: [unitedcreditltd@gmail.com](mailto:unitedcreditltd@gmail.com), Website: [www.unitedcreditltd.com](http://www.unitedcreditltd.com)

**PUBLIC NOTICE FOR PROPOSED VOLUNTARY DELISTING OF EQUITY SHARES FROM THE CALCUTTA STOCK EXCHANGE LIMITED**

Notice is hereby given that pursuant to Regulations 5 and 6 of the Securities and Exchange Board of India (Delisting of Equity Shares) Regulations, 2021 ("SEBI Delisting Regulations"), the Board of Directors of UNITED CREDIT LIMITED ("the Company") at its meeting held on May 28, 2025, has approved, inter alia, a proposal for the voluntary delisting of its equity shares from the Calcutta Stock Exchange Limited only.

Presently, the equity shares of the Company are listed on both the Bombay Stock Exchange Limited ("BSE") and the Calcutta Stock Exchange Limited ("CSE"). Since there has been no trading in the equity shares of the Company at the CSE for the last many years and the Company also incurs extra operational costs of being listed on the CSE, therefore, it is being proposed to delist the equity shares of the Company from the CSE only. The proposed delisting from CSE will not be prejudicial to or affect the interests of the investors.

In terms of Regulation 6 of the SEBI Delisting Regulations, the Company has proposed the delisting of its equity shares from the CSE only without giving any exit opportunity to the equity shareholders of the Company, as the equity shares of the Company will remain to be listed on the Bombay Stock Exchange Limited, having nationwide trading terminals. Subsequently, all the shareholders of the Company shall continue to avail the benefits of listing and trading at the Bombay Stock Exchange Limited ("BSE").

For UNITED CREDIT LIMITED  
Sd/-  
Deepali Gupta  
Company Secretary & Compliance Officer

Place : Kolkata  
Date : 29.05.2025



CIN:L65990MH1985PLC038164

Regd. Office : 214, Empire House, Dr. D. N. Road, Ent. A. K. Nayak Marg, Fort, Mumbai – 400 001.  
Website: [www.weizmann.co.in](http://www.weizmann.co.in), Email: [contact@weizmann.co.in](mailto:contact@weizmann.co.in)  
Tel. Nos :022-22071501 ( 6 lines) Fax No.: 022-22071514

**STATEMENT OF AUDITED FINANCIAL RESULTS (STANDALONE AND CONSOLIDATED) FOR THE QUARTER AND YEAR ENDED 31<sup>ST</sup> MARCH, 2025**

The Board of Directors of the Company, at the meeting held on 27<sup>th</sup> May, 2025 approved the Audited Financial Results (Standalone and Consolidated) of the Company for the quarter and year ended 31<sup>st</sup> March, 2025.


The results along with the Auditor's Report have been posted on the website of the Company <https://weizmann.co.in/financial-results.html> and can be accessed by scanning the QR Code.

**Place: Mumbai**  
**Date: 27<sup>th</sup> May, 2025**

Note: The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.



For Weizmann Limited  
SD/-  
Neelkamal V Siraj  
Vice Chairman and Managing Director  
DIN: 00021986



**MAMATA MACHINERY**  
VALUE FOR TRUST

CIN: U29259GJ1979PLC003363  
Regd. Office: Survey No. 423/P, Sarkhej-Bavla Road, Moraiya Sanand, Ahmedabad, Gujarat – 382213  
email: [cs@mamata.com](mailto:cs@mamata.com) • website: [www.mamata.com](http://www.mamata.com)


**STATEMENT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED ON MARCH 31, 2025**

The Board of Directors of the Company, at their Meeting held on May 28, 2025 approved the Audited Financial Results (Standalone & Consolidated) of the Company for the Quarter and Year Ended on March 31, 2025


The results, along with the Auditors' Report, have been posted on the Company's website at <https://www.mamata.com/investors> and can be accessed by Scanning the QR Code.

**Place : Ahmedabad**  
**Date : May 28, 2025**

Note : The above intimation is in accordance with Regulation 33 read with Regulation 47(1) of the SEBI (Listing Obligation & Disclosure Requirements) Regulation, 2015.



By Order of the Board  
For, **MAMATA MACHINERY LIMITED**  
Sd/-  
**Mahendra N. Patel**  
Chairman & Managing Director



**MUKTA ARTS LIMITED**


CIN:L92110MH1982PLC028180  
Regd. Office : Mukta House, Behind Whistling Woods Institute, Filmcity Complex, Goregaon (East), Mumbai- 400 065.Tel. No. (022) 33649400. Website : [www.muktaarts.com](http://www.muktaarts.com)

**Statement of Standalone & Consolidated Financial Results for the Quarter and Year ended 31<sup>st</sup> March, 2025** (Rs in lakhs)

| Particulars                                                                                                                         | Standalone               |                               | Consolidated             |                               |
|-------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------|-------------------------------|--------------------------|-------------------------------|
|                                                                                                                                     | For the quarter ended    |                               | For the quarter ended    |                               |
|                                                                                                                                     | March 31, 2025 (Audited) | December 31, 2024 (Unaudited) | March 31, 2025 (Audited) | December 31, 2024 (Unaudited) |
| Total income from operations (net)                                                                                                  | 449.33                   | 548.79                        | 2,031.69                 | 2,751.59                      |
| Net Profit / (Loss) (before tax, Exceptional items)                                                                                 | 253.07                   | 438.78                        | 882.42                   | 1,133.38                      |
| Net Profit / (Loss) before tax, (after Exceptional items)                                                                           | 253.07                   | 438.78                        | 882.42                   | 1,133.38                      |
| Net Profit / (Loss) for the period after tax (after Exceptional items)                                                              | 229.91                   | 374.72                        | 779.70                   | 1,043.67                      |
| Total Comprehensive Income for the period (Comprising Profit for the period (after tax) and other Comprehensive Income (after tax)) | 188.24                   | 374.72                        | 738.04                   | 1,045.92                      |
| Equity share capital (In Rs.)                                                                                                       | 11,29,26,000             | 11,29,26,000                  | 11,29,26,000             | 11,29,26,000                  |
| Earnings Per Share (of Rs. 5/- each) Basic & Diluted:                                                                               | 0.86                     | 1.66                          | 3.30                     | 4.58                          |


**Note:**

- The above is an extract of the detailed format of Quarterly/Annual Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/Annual Financial Results are available on the Stock Exchange websites. (URL of the filings)
- The above results were reviewed and recommended by Audit Committee and approved by the Board of Directors of the Company at their meeting held on 28th May, 2025.
- These financial results have been prepared in accordance with Indian Accounting Standards (Ind AS) prescribed under Section 133 of the Companies Act, 2013 and other recognized accounting practices and policies to the extent possible. Please find below the QR Code for attachment in Newspaper



**Date: May 28, 2025**  
**Place: Mumbai**

For Mukta Arts Limited  
For and on behalf of Board of Directors  
Sd/-  
Rahul Puri  
Managing Director  
DIN: 01925045



**YUKEN INDIA LIMITED**

Regd. Office: No 16 - C, Doddanekundi Industrial Area, Mahadevapura, Bangalore 560 048, India.

**EXTRACT OF AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND YEAR ENDED 31 MARCH 2025**

CIN : L29150KA1976PLC003017 (₹ in lakhs, except per share data)

| Sl.No. | Description                                                                                                                                | CONSOLIDATED  |            |            |            | STANDALONE    |            |            |            |
|--------|--------------------------------------------------------------------------------------------------------------------------------------------|---------------|------------|------------|------------|---------------|------------|------------|------------|
|        |                                                                                                                                            | Quarter Ended |            | Year Ended |            | Quarter Ended |            | Year Ended |            |
|        |                                                                                                                                            | 31.03.2025    | 31.03.2024 | 31.03.2025 | 31.03.2024 | 31.03.2025    | 31.03.2024 | 31.03.2025 | 31.03.2024 |
|        |                                                                                                                                            | AUDITED       | AUDITED    | AUDITED    | AUDITED    | AUDITED       | AUDITED    | AUDITED    | AUDITED    |
| 1      | Total Income from Operations                                                                                                               | 12,559.14     | 12,073.46  | 46,109.38  | 42,762.71  | 10,346.96     | 10,609.30  | 39,693.03  | 37,097.78  |
| 2      | Net Profit for the period (before Tax and Exceptional Items)                                                                               | 912.91        | 1,096.39   | 3,166.91   | 2,696.10   | 534.88        | 905.62     | 1,796.90   | 2,095.67   |
| 3      | Net Profit for the period (before Tax and after Exceptional Items)                                                                         | 912.91        | 1,096.39   | 3,166.91   | 2,696.10   | 534.88        | 905.62     | 1,796.90   | 2,095.67   |
| 4      | Net Profit/(loss) for the period (after Tax and after Exceptional Items)                                                                   | 784.66        | 793.31     | 2,460.16   | 1,878.55   | 504.73        | 642.24     | 1,384.00   | 1,459.29   |
| 5      | Total Comprehensive Income for the period (comprising Profit/(loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)) | 682.31        | 744.94     | 2,357.81   | 1,830.18   | 410.34        | 608.03     | 1,289.61   | 1,425.08   |
| 6      | Paid up equity share capital (Face value Rs.10/- per share)                                                                                | 1,300.00      | 1,300.00   | 1,300.00   | 1,300.00   | 1,300.00      | 1,300.00   | 1,300.00   | 1,300.00   |
| 7      | Earnings per Share (of Rs.10/- each) (not annualised) - Basic & Diluted                                                                    | 6.03          | 6.11       | 18.94      | 14.75      | 3.88          | 4.94       | 10.65      | 11.44      |

**NOTES:**

- The above is an extract of the detailed format of Financial results for the quarter and Year ended 31 March, 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly financial results are available on the stock exchange website [www.bseindia.com](http://www.bseindia.com), [www.nseindia.com](http://www.nseindia.com) and on Company's website [www.yukenindia.com](http://www.yukenindia.com)
- The above audited standalone and consolidated financial results of the Company have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on 28 May 2025. The Statutory Auditors of the Company have carried out audit of the above financial results.
- The Board of Directors have recommended payment of final dividend of 15% (₹ 1.5 per equity share) for the financial year ended 31 March 2025.

By Order of the Board of Directors  
**C P RANGACHAR**  
Managing Director

**Place : Bangalore**  
**Date : 28.05.2025**